

જ્યુઝ આંદ્ર ગાંધીનગર

NEWS OF GANDHINAGAR (Daily) દૈનિક

*Editor : Pradip A. Raval (Mo) 98246 53073 * Block No.677/2, Gh Type, Sector - 8, Gandhinagar (Gujarat)

* Volume : 10 * Issue No. 311 * Date: 01.09.2024, Sunday * Page :04 * Rs. 1.00/- * Annual Rs. 351/-

રાત્રે ડ્યુટી કરનારા ૩૫ ટકા ડોક્ટર અસુરક્ષિત : IMA ના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો



કોલકાતામાં ટ્રેઈની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા અંગે લોકોમાં રોધની લાગણી હજી સુધી શાંત પડી નથી. આ વચ્ચે આઈએમએ દ્વારા ડોક્ટરોની સુરક્ષા અંગે કરવામાં આવેલા નવા સર્વેમાં ચિંતાજનક માહિતી સામે આવી છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના અભ્યાસમાં રાત્રે ડ્યુટી કરનારા ૩૫.૫ ટકા ડોક્ટર 'અસુરક્ષિત' સર્વેમાં ૪૫ ટકા ડોક્ટરોએ જણાવ્યું કે તેમના

કાર્ય સ્થળો પર નાઈટ ડ્યુટી માટે અલગ રૂમની સુવિધા નથી. આ ઉપરાંત દર ત્રણમાંથી એક ડ્યુટી રૂમમાં શૌચાલયની સુવિધા પણ નથી છે. પ્રાઈવેસી પણ હોતી નથી. ૫૩ ટકા ડ્યુટી રૂમ વોર્ડ અથવા ઈમરજન્સી વોર્ડથી ૧૦૦થી ૧૦૦૦ મીટર સુધી દુર હોય છે. સર્વેમાં જે ડોક્ટરોની વય ૩૫ વર્ષથી ઓછી હતી, તેમાંથી ૬૧ ટકા ટ્રેઈની અથવા પીજી ટ્રેઈની હતા. જેમાં ૨૪.૧ ટકા ડોક્ટરોએ જણાવ્યું કે તેઓ ફરજ દરમિયાન પોતાની જાતને 'અસુરક્ષિત' અને ૧૧.૪ ટકા ડોક્ટર પોતાની જાતને 'અતિ અસુરક્ષિત' અનુભવે છે.

સર્વેક્ષણમાં આ વાત પણ સામે આવી કે ઘણા ક્ષેત્રોમાં ડ્યુટી રૂમની પણ અછત છે અને જેમને ડ્યુટી રૂમની સુવિધા ઉપલબ્ધ છે ત્યાં પ્રાઈવેસીની અછત હતી અને ઘણાં રૂમમાં તાળા પણ નહોતા. આ ઉપરાંત દર ત્રણમાંથી એક ડ્યુટી રૂમમાં શૌચાલયની સુવિધાનો પણ અભાવ હતો. આ કારણસર, ઘણાં ડોક્ટર મોટાભાગે વૈકલ્પિક આરામ ગૃહમાં રૂમ ભૂક કરાવવા પડતા હતા.

પૂરમાં ફસાયેલા વિદેશીઓ સવાર થયા બુલડોઝર પર, સો.મીડિયા પર વાયરલ વીડિયોથી ફૂલુહલ વડોદરામાં પૂરના પાણી વચ્ચે ફસાયેલા વિદેશીઓને બુલડોઝર વડે પૂરના પાણીમાંથી સલામત સ્થળે લઈ જવાતા હોવાનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિડિયોમાં વિદેશીઓ બુલડોઝર પર ઉભા રહેલા જોવા મળી રહ્યાં છે. પાણી વચ્ચેથી બુલડોઝર પર ઉભા રહીને નીકળવાનો અનુભવ લઈ રહેલા વિદેશી પ્રવાસીઓના ચહેરા પર પણ હાસ્ય જોઈ શકાય છે. એવું કહેવાય છે કે, વિદેશી પ્રવાસીઓનું આ જૂથ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયું હતું. તેઓ વડોદરાના જેતલપુર વિસ્તારની કોઈ હોટલમાં રોકાયા હતા અને સોમવારે પહેલા ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જતા આ વિસ્તારની સેકડો હોટલોમાં રોકાયેલા પ્રવાસીઓને જેમ તેઓ પણ ફસાઈ ગયા હતા. એ પછી તંત્રનું કોઈએ ધ્યાન દોર્યું હતું અને આ પ્રવાસીઓને હોટલમાંથી સલામત સ્થળે ખસેડવા માટે બુલડોઝર બોલાવવામાં આવ્યું હતું. ૬ જેટલા વિદેશી પ્રવાસીઓના જૂથને એક સાથે પૂરના પાણીથી દૂર લઈ જવા માટે બુલડોઝરના આગલા હિસ્સામાં ઉભા રાખવામાં આવ્યા હતા. તેમને લઈને બુલડોઝર રસ્તા પરથી જઈ રહ્યું હતું ત્યારે કોઈએ વિડિયો ઉતારી લીધો હતો.

અપહરણ-દુષ્કર્મ કેસમાં ૧૦ વર્ષ કેદની સજા:યાણસ્મા પંથકની સગીરાનું અપહરણ કર્યા બાદ દુષ્કર્મ ગુજાર્યું હતું, પાટણ પોક્સો કોર્ટનો ચૂકાદો પાટણની સ્પેશ્યલ પોક્સો કોર્ટે યાણસ્મા પંથકની એક સગીરાનાં અપહરણ અને દુષ્કર્મનાં કેસમાં તેનાં જ ગામનાં આરોપીને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ. બે લાખ ઉપરાંતનો દંડ ફટકાર્યો હતો. દંડ ન ભરે તો તેની અવેજમાં ત્રણથી છ માસની સખ્ત કેદની સજા ભોગવવાનો આદેશ કર્યો હતો. તથા દંડની રકમ વસુલ આવે તો તેમાંથી પિડીતાને રૂ. બે લાખનું વળતર ચૂકવવા તથા જો આરોપી દંડ ન વસુલ આપે તો પાટણ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ આ વળતર ચૂકવવા ભલામણ પાટણનાં સ્પેશ્યલ પોક્સો કોર્ટના જજ સુનિલભાઈ એમ. ટાકે કરી

મળી આવતાં પોક્સોની કલમોનો વધારો કરાયો હતો. આ કેસ પાટણની સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી જતાં જજે બંને પક્ષોની રજૂઆતો સાંભળીને આઈપીસી ૩૦૬ અંતર્ગત ત્રણ વર્ષની સખ્ત કેદ અને રૂ. ૨૦૦નો દંડ અને દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સખ્ત કેદ, પોક્સો એક્ટ ૩(એ)માં ૭ વર્ષની સખ્ત કેદ અને રૂ. ૫૦ હજારનો દંડ અને દંડ ન ભરે તો છ માસની સખ્ત કેદ પોક્સો એક્ટની કલમ ૫(એલ), ૫ (જેટ્ટ) અને ૫ (ક્યુ) કલમ ૬ અંતર્ગત ૧૦-૧૦ વર્ષની સખ્ત કેદને અને દરેકમાં રૂ. ૫૦-૫૦ હજારનો દંડ મળી કુલે રૂ. ૨ લાખ ઉપરાંતનો દંડ ફટકાર્યો હતો.

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષની વાવેતરની સરેરાશ સામે હજી ૧૧ હજાર હેક્ટરમાં વાવેતર બાકી



ગાંધીનગર જિલ્લામાં સાર્વજનિક મેઘ મહેરથી ઉભા પાકને જાણે જીવનદાન મળી ગયું છે. ડાંગર, મગફળી અને કપાસના વાવેતરમાં સામાન્ય વધારો નોંધવાની સાથે કુલ વાવેતર ૮૮ ટકાએ પહોંચ્યું છે. જ્યારે છેલ્લા ત્રણ વર્ષની વાવેતરની સરેરાશ સામે હજી ૧૧ હજાર હેક્ટરમાં વાવેતર બાકી છે. ગાંધીનગર જિલ્લામાં થયેલી મેઘમહેરથી ૧૫ હજાર ૫૦૫ હેક્ટર સાથે દિવેલાનું વાવેતર વધ્યું છે. ગાંધીનગર ખેતીવાડી શાખાના સુત્રોના જણાવવા પ્રમાણે ખરીફ મોસમમાં મુખ્ય પાક ગણાતાં કપાસનું વાવેતર ૧૮ હજાર ૨૨૫ હેક્ટરમાં, મગફળીનું વાવેતર ૧૫ હજાર ૮૭૮ હેક્ટરમાં, દિવેલાનું વાવેતર ૧૫ હજાર ૫૦૫ હેક્ટરમાં થયું છે. એજ રીતે ડાંગરનું વાવેતર ૧૧ હજાર ૭૪૩ હેક્ટર વિસ્તાર સુધી પહોંચ્યું છે. આ ઉપરાંત ગુવારનું વાવેતર પણ ૩ હજાર ૫૮૨ હેક્ટરમાં થયાનું નોંધવામાં આવ્યું છે. જ્યારે ઘાસચારાનું વાવેતર ૩૦ હજાર ૮૮૩ હેક્ટરમાં ખેડૂતોએ કર્યું છે. ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષની ખરીફ પાકના વાવેતરની સરેરાશ ૧ લાખ ૨૭ હજાર ૮૬ હેક્ટરની છે. તેની સામે અત્યાર સુધીમાં ૧ લાખ ૧૩ હજાર ૨૦૩ હેક્ટર વિસ્તારમાં ખેડૂતો દ્વારા વિવિધ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે દહેગામ તાલુકામાં ૮૧ ટકા વિસ્તાર સાથે ૩૭ હજાર ૧૧૬ હેક્ટરમાં, કલોલ તાલુકામાં ૮૦ ટકા વિસ્તાર સાથે ૨૪ હજાર ૪૭ હેક્ટરમાં, ગાંધીનગર તાલુકામાં ૮૭ ટકા વિસ્તાર સાથે ૨૭ હજાર ૮૮૧ હેક્ટરમાં અને માણસા તાલુકામાં પણ ૮૭ ટકા વિસ્તાર સાથે ૨૭ હજાર ૮૮૧૨૭ અને માણસા તાલુકામાં પણ ૮૭ ટકા વિસ્તાર સાથે ૨૪ હજાર ૪૮ હેક્ટર વિસ્તારમાં વિવિધ ખરીફ પાકનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે તેમ વધુમાં સુત્રોએ જણાવ્યું છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં લીલા દુષ્કાળની ભીતિ, પ જિલ્લામાં દોટથી અટી ગણો વરસાદ સૌરાષ્ટ્ર-કચ્છમાં ગત ૫ દિવસમાં કેટલાક સ્થળોએ અતિશય ધોધમાર અતિ વૃષ્ટિ થતા હવે લીલા દુષ્કાળનો ભય સર્જાયો છે. હજી ચોમાસુ અને વરસાદની આગાહી તો જાહેર છે ત્યાં જ મોરબી જિ.માં ૧૪૫ ટકા, જામનગર જિ.માં ગયો

અપહરણ-દુષ્કર્મ કેસમાં ૧૦ વર્ષ કેદની સજા:યાણસ્મા પંથકની સગીરાનું અપહરણ કર્યા બાદ દુષ્કર્મ ગુજાર્યું હતું, પાટણ પોક્સો કોર્ટનો ચૂકાદો

પાટણની સ્પેશ્યલ પોક્સો કોર્ટે યાણસ્મા પંથકની એક સગીરાનાં અપહરણ અને દુષ્કર્મનાં કેસમાં તેનાં જ ગામનાં આરોપીને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ. બે લાખ ઉપરાંતનો દંડ ફટકાર્યો હતો. દંડ ન ભરે તો તેની અવેજમાં ત્રણથી છ માસની સખ્ત કેદની સજા ભોગવવાનો આદેશ કર્યો હતો. તથા દંડની રકમ વસુલ આવે તો તેમાંથી પિડીતાને રૂ. બે લાખનું વળતર ચૂકવવા તથા જો આરોપી દંડ ન વસુલ આપે તો પાટણ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ આ વળતર ચૂકવવા ભલામણ પાટણનાં સ્પેશ્યલ પોક્સો કોર્ટના જજ સુનિલભાઈ એમ. ટાકે કરી



હતી. આ કેસની વિગતો એવી છે કે, યાણસ્મા તાલુકાના એક ગામની સગીરા તા. ૫-૪-૧૮નાં અરસામાં ગુમ થતાં તેની શોધખોળ છતાં તે નહિ મળતાં તેનાં જ ગામનો યુવાન તેને ભગાડી ગયો હોવાની અપહરણની ફરીયાદ નોંધાવાઈ હતી. તે અંગેની તપાસ દરમિયાન આ કિશોરી અને યુવાન આરોપી

અમદાવાદ, ભારતીય માનક બ્યુરોના, અમદાવાદ શાખા કાર્યાલય અધિકારીઓ દ્વારા આઈએસઆઈ માર્ક વિનાના રમકડાં બનાવાની માહિતીના આધાર પર તારીખ ૨૮.૦૮.૨૦૨૪ના રોજ અમદાવાદ સ્થિત મેસર્સ મહાજાનિક ઉદ્યોગ, સર્વે નંબર ૧૦૩૮, ષોટ નંબર ૯૫ થી ૯૯, વારાહી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, ભાવડા, તાલુકા દસ્ક્રોઈ, અમદાવાદ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી. દરોડા દરમિયાન ઉત્પાદક પાસેથી સ્ટાન્ડર્ડ માર્ક વગરના ૬૦૦૦ થી વધારે રમકડાંઓ જપ્ત કરવામાં આવ્યા. ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનાં ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૦ ના ઓર્ડર નંબર જી. ૮૫૩ અને ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૦ના સુધારા મુજબ, આવા ઉત્પાદનો (રમકડાં) અથવા સામાન અથવા ૧૪ વર્ષથી ઓછી ઉંમરના બાળકોનાં રમવા માટેના હેતુથી બનાવેલ વસ્તુઓ ઉપર આઈ.એસ.આઈ માર્ક ૦૧ જાન્યુઆરી ૨૦૨૧ પછી ફરજિયાત કરવામાં આવ્યો છે અર્થાત કોઈપણ ઉત્પાદક અથવા વેપારી માર્ક વિના રમકડાંનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરી શકશે નહીં અને માત્ર એવા ઉત્પાદકોને જોઈ માર્ક લાગુ કરવાની મંજૂરી છે કે જેમની પાસે ભારતીય માનક બ્યુરોનું માન્ય લાઈસન્સ છે. બ્યુરો પાસેથી માન્ય લાઈસન્સ લીધા વિના ઉત્પાદકો દ્વારા આઈ એસ આઈ માર્ક લગાવવું અથવા આઈ એસ આઈ માર્ક વિના રમકડાં બનાવવા, વેચવા અને સંગ્રહ કરવા એ સજાપાત્ર ગુનો છે. આવું કરનારનાં વિરુદ્ધ ભારતીય માનક બ્યુરો અધિનિયમ ૨૦૧૬ના અનુચ્છેદ ૧૭ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. આ અપરાધ દંડનીય છે, જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રૂપિયા ૨,૦૦,૦૦૦/- આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.

૫ રાજ્યમાં પોષણ ટ્રેકર એપમાં ફેસ ઓથેન્ટિકેશનનો નગરમાંથી પ્રારંભ

દેશના પાંચ રાજ્યમાં પોષણ ટ્રેકર એપમાં ફેસ ઓથેન્ટિકેશન ફીચરના પાયલોટ પ્રોજેક્ટનો આરંભ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યો હતો. ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારમાં આવેલી સેક્ટર -૩ ન્યૂની આંગણવાડીની મુલાકાત કેન્દ્રીય મહિલા અને બાળ વિભાગના મંત્રી અમ્મણી દેવીએ લીધી હતી જ્યાંથી પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો હતો. કેન્દ્રીય મંત્રી અમ્મણી દેવી અને ગુજરાતના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ ગુજરાત રાજ્ય સહિત દેશના પાંચ રાજ્યમાં અમલી થનાર પાયલોટ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું. અને સગર્ભા, ધાત્રીમાતાને પોષણશક્તિ પેકેટનું પાયલોટ પ્રોજેક્ટ થકી વિતરણ કર્યું હતું. પોષણ ટ્રેકર એપમાં ફેસ ઓથેન્ટિકેશન ટેક હોમ રાશન (ટીએચઆર)નો લાભ ફક્ત વાસ્તવિક લાભાર્થીઓ સુધી જ પહોંચે તે માટે ભારત સરકાર દ્વારા પોષણ ટ્રેકર એપમાં ફેસ ઓથેન્ટિકેશન ફીચર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં સૌપ્રથમ આંગણવાડી કાર્યકર દ્વારા લાભાર્થીના ચહેરાને એપમાં રજિસ્ટર કરવામાં આવશે. ત્યારબાદ દર વખતે ટીએચઆર વિતરણ સમયે, લાભાર્થીના ચહેરાને એપના માધ્યમથી મેચ કરવામાં આવશે. જેની સાથે લાભાર્થીના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક્ઝિટ મોકલવામાં આવશે. લાભાર્થીને મળેલ એપમાં દાખલ કરવામાં આવશે. સફળ ચહેરા ઓળખ અને ચકાસણી પછી જ, આંગણવાડી કાર્યકર લાભાર્થીને ટીએચઆર આપી શકશે. આ ફેસ ઓથેન્ટિકેશનથી આંગણવાડી કાર્યકરની કાર્યપદ્ધતિને પારદર્શક બનાવશે. આ એપ ગુજરાત રાજ્યમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારના એક - એક ઘટકમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમલી બનાવવામાં આવી છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં લીલા દુષ્કાળની ભીતિ, પ જિલ્લામાં દોટથી અટી ગણો વરસાદ



૧૫૯ ટકા, દારકા જિલ્લામાં ૨૫૧ ટકા (અઢી ગણો), પોરબંદરમાં ૧૮૦ ટકા અને જુનાગઢમાં ૧૫૨ ટકા (દોઢ ગણો) વરસાદ વરસી ગયો છે અને આ વરસાદ પણ સમતોલ દરેક તાલુકામાં સમાન રીતે નહીં પણ જ્યાં ખાબક્યો ત્યાં એક સાથે ખાબક્યો છે જેથી કૃષિપાકનું ધોવાણ થયું છે. રાજ્યના ૩૭ તાલુકામાં ૧૪૦ ટકાથી વધુ વરસાદ વરસી

રમકડાના ઉત્પાદક પર ભારતીય માનક બ્યુરોના દરોડા

અમદાવાદ, ભારતીય માનક બ્યુરોના, અમદાવાદ શાખા કાર્યાલય અધિકારીઓ દ્વારા આઈએસઆઈ માર્ક વિનાના રમકડાં બનાવાની માહિતીના આધાર પર તારીખ ૨૮.૦૮.૨૦૨૪ના રોજ અમદાવાદ સ્થિત મેસર્સ મહાજાનિક ઉદ્યોગ, સર્વે નંબર ૧૦૩૮, ષોટ નંબર ૯૫ થી ૯૯, વારાહી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, ભાવડા, તાલુકા દસ્ક્રોઈ, અમદાવાદ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી. દરોડા દરમિયાન ઉત્પાદક પાસેથી સ્ટાન્ડર્ડ માર્ક વગરના ૬૦૦૦ થી વધારે રમકડાંઓ જપ્ત કરવામાં આવ્યા. ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનાં ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૦ ના ઓર્ડર નંબર જી. ૮૫૩ અને ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૦ના સુધારા મુજબ, આવા ઉત્પાદનો (રમકડાં) અથવા સામાન અથવા ૧૪ વર્ષથી ઓછી ઉંમરના બાળકોનાં રમવા માટેના હેતુથી બનાવેલ વસ્તુઓ ઉપર આઈ.એસ.આઈ માર્ક ૦૧ જાન્યુઆરી ૨૦૨૧ પછી ફરજિયાત કરવામાં આવ્યો છે અર્થાત કોઈપણ ઉત્પાદક અથવા વેપારી માર્ક વિના રમકડાંનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરી શકશે નહીં અને માત્ર એવા ઉત્પાદકોને જોઈ માર્ક લાગુ કરવાની મંજૂરી છે કે જેમની પાસે ભારતીય માનક બ્યુરોનું માન્ય લાઈસન્સ છે. બ્યુરો પાસેથી માન્ય લાઈસન્સ લીધા વિના ઉત્પાદકો દ્વારા આઈ એસ આઈ માર્ક લગાવવું અથવા આઈ એસ આઈ માર્ક વિના રમકડાં બનાવવા, વેચવા અને સંગ્રહ કરવા એ સજાપાત્ર ગુનો છે. આવું કરનારનાં વિરુદ્ધ ભારતીય માનક બ્યુરો અધિનિયમ ૨૦૧૬ના અનુચ્છેદ ૧૭ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. આ અપરાધ દંડનીય છે, જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રૂપિયા ૨,૦૦,૦૦૦/- આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.

તંત્રી લેખ.....

દેશના સૌથી વધુ અમીર ભારતીયોની યાદીમાં ગૌતમ અદાણી ફરી એકવાર ટોપ પર

દેશના અગ્રણી બિઝનેસ ગ્રુપ અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણી અને તેમના પરિવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પરિવારને પાછળ છોડ્યા છે. ૧.૧૬ લાખ કરોડની કુલ સંપત્તિ સાથે ગૌતમ અદાણીએ દેશના ધનિકોની યાદીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ૨૦૨૪ ની હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં ગૌતમ અદાણીએ સૌથી ધનવાન ભારતીય બન્યા છે. હિન્ડેનબર્ગ રિપોર્ટથી થયેલા નુકસાનને ભરપાઈ કરતાં ગૌતમ અદાણીની નેટવર્થ ગત વર્ષે ૮૫ ટકા વધી હતી. આ યાદીમાં મુકેશ અંબાણી અને તેમના પરિવારની કુલ સંપત્તિ ૧૦.૧૪ લાખ કરોડ રૂપિયા અંદાજવામાં આવી હતી અને તેઓ આ યાદીમાં બીજા ક્રમે છે. હુરુન ઈન્ડિયાની એક રીલીઝ મુજબ અમીરોની યાદીમાં સમાવિષ્ટ તમામ વ્યક્તિઓ અને પરિવારોની સંપત્તિની ગણતરી ૩૧ જુલાઈ, ૨૦૨૪ના રોજ લીધેલા સ્નેપશોટ આધારિત છે. નોંધનીય છે કે, યુએસ સ્થિત શોર્ટ સેલર હિન્ડેનબર્ગ રિસર્ચ દ્વારા લગાવવામાં આવેલા વિવિધ આરોપોને પગલે અદાણીની નેટવર્થમાં ઘટાડો થયો હતો. પ્રકાશિત રિપોર્ટમાં જણાવાયું છે કે ગત વર્ષે ભારતમાં દર પાંચ દિવસે એક અબજોપતિ પેદા થયા છે અને ૨૦૨૩માં દેશમાં ૨૫૯ અબજોપતિ હતા, જ્યારે હવે તેમની સંખ્યા વધીને ૩૩૪ થઈ ગઈ છે.

હુરુન ઈન્ડિયાના સ્થાપક અને મુખ્ય રિસર્ચર અનસ રહેમાન જુનેદ જણાવે છે કે, “ભારત એશિયાના સંપત્તિ સર્જન એન્જિન તરીકે ઉભરી રહ્યું છે!” તેમણે ઉમેર્યું હતું કે ભારતમાં અબજોપતિઓની સંખ્યામાં ૨૯ ટકાનો વધારો થયો છે, જ્યારે ચીનમાં અબજોપતિઓની સંખ્યામાં ૨૫ ટકાનો ઘટાડો થયો છે. ઝંઝ-ટેકનોલોજિસના શિવ નાદર અને તેમનો પરિવાર આ વર્ષના અમીરોની યાદીમાં ત્રીજા ક્રમે છે, તેમની કુલ સંપત્તિ ૩.૧૪ લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. આ યાદીમાં ચોથા સ્થાને પૂનાવાલા અને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (જી) પરિવારના સાયરસ એસ પુનાવાલા અને પાંચમા સ્થાને ? ૨.૪૯ કરોડની સંપત્તિ સાથે સન ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીઝના દિલીપ સંઘવી સામેલ છે. આ વર્ષે હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં કુલ ૧,૫૩૯ લોકો સામેલ થયા છે, જેમની કુલ સંપત્તિનું મૂલ્ય ? ૧,૦૦૦ કરોડથી વધુ છે. ૧,૫૩૯નો આ આંકડો ગયા વર્ષ કરતાં ૨૨૦ વધુ છે. રિચ લિસ્ટ ૨૦૨૪માં પહેલીવાર ૨૭૨ લોકોના નામ નોંધાયા છે. આ વર્ષે ? ૧,૦૦૦ કરોડથી વધુની સંપત્તિના માલિકોની સંખ્યા પ્રથમ વખત ૧,૫૦૦નો આંકડો વટાવી ગઈ છે અને છેલ્લા પાંચ વર્ષમાં તેમાં ૮૬ ટકાનો વધારો થયો છે. રિચ લિસ્ટ ૨૦૨૪માં ૧૮ લોકોની કુલ સંપત્તિ ? ૧ લાખ કરોડથી વધુ છે. ગયા વર્ષે આ આંકડો ૧૨ હતો, અને ૧૦ વર્ષ પહેલાં હુરુન ઈન્ડિયાની યાદીમાં ફક્ત બે જ લોકોની કુલ સંપત્તિ ૧ લાખ કરોડ રૂપિયાથી વધુ હતી.

નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વાસ્તવિક જીડીપીમાં ૬.૭ ટકાનો વધારો થવાનો અંદાજ

નવી દિલ્હી,

આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (એમઓ એ સપીઆઈ)ની નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (એનએસઓ) આ પ્રેસ નોટમાં નાણાકીય વર્ષ (નાણાકીય વર્ષ) ૨૦૨૪-૨૫ના એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળા (ક્વાર્ટર ૧) માટે કુલ ઘરેલું ઉત્પાદન (જીડીપી)ના ત્રિમાસિક અંદાજો રજૂ કરી રહ્યું છે, જેમાં કોન્સ્ટન્ટ (૨૦૧૧-૧૨) અને વર્તમાન કિંમતો એમ બંને પર તેના ભરખના ઘટકો સામેલ છે. વર્ષ ૨૦૨૨-૨૩, ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫ના ક્વાર્ટર-૧ માટે જીડીપીના ભરખ ઘટકોમાં વર્ષ દર વર્ષે ટકા ફેરફારો અને ભરખના ઘટકોની સાથે આર્થિક પ્રવૃત્તિના પ્રકાર દ્વારા મૂળભૂત કિંમતે કુલ



મૂલ્ય સંવર્ધિત (જીવીએ)નો ત્રિમાસિક અંદાજ પરિશિષ્ટ એ ના વિધાન ૧ થી ૪માં આપવામાં આવ્યો છે.

કી હાઈલાઈટ્સ:
● નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના ક્વાર્ટર ૧ માં વાસ્તવિક

જીડીપીમાં ૬.૭ ટકાનો વધારો થવાનો અંદાજ છે, જે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ ના ક્વાર્ટર ૧ માં ૮.૨% ના વિકાસ દર કરતા વધારે છે.

● નોમિનલ જીડીપીમાં નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના

ક્વાર્ટર ૧માં ૮.૭ ટકાનો વૃદ્ધિ દર જોવા મળ્યો છે, જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૮.૫ ટકાનો વૃદ્ધિ દર હતો.

● વાસ્તવિક જીવીએ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૬.૮ ટકાનો વધારો થયો છે, જે અગાઉના નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૮.૩ ટકાના વૃદ્ધિ દરની સરખામણીમાં હતો. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના ક્વાર્ટર ૧માં જીવીએ વૃદ્ધિ સેક્ટરની સેક્ટર (૮.૪ ટકા)માં નોંધપાત્ર વૃદ્ધિથી પ્રેરિત છે, જેમાં કન્સ્ટ્રક્શન (૧૦.૫ ટકા), ઈલેક્ટ્રિસિટી, ગેસ, વોટર સપ્લાય અને અન્ય યુટિલિટી સર્વિસીસ (૧૦.૪

ટકા) અને મેન્યુફેક્ચરિંગ (૭.૦ ટકા) ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

● નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના ક્વાર્ટર ૧ માટે નોમિનલ જીવીએમાં વૃદ્ધિ દર નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૮.૨ ટકાના વૃદ્ધિ દરથી ૮.૮ ટકા રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.

● પ્રાઇવેટ ફાઇનલ કન્સમ્પ્શન એક્સપેન્ડિચર (પીએફસીઈ) અને ગ્રોસ ફિક્સડ કેપિટલ ફોર્મેશન (જીએફસીએફ)માં સ્થિર ભાવે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં અનુક્રમે ૭.૪ ટકા અને ૭.૫ ટકાનો વૃદ્ધિ દર જોવા મળ્યો

છે.

● વર્તમાન ભાવે ચોખ્ખા કરવેરામાં નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૮.૦ ટકાનો વૃદ્ધિ દર જોવા મળ્યો છે, જેના પરિણામે જીવીએ અને જીડીપીના વૃદ્ધિ દર વચ્ચે ૦.૧ ટકાનો ઈન્ટ ગેપ જોવા મળ્યો છે.

૨૦૨૪-૨૫ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સ્થિર ભાવે વાસ્તવિક જીડીપી અથવા જીડીપી ? ૪૩.૬૪ લાખ કરોડ થવાનો અંદાજ છે, જે ૨૦૨૩-૨૪ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ? ૪૦.૯૧ લાખ કરોડ હતો, જે ૬.૭%નો વૃદ્ધિ દર દર્શાવે છે.

સ્પોર્ટ્સ ડે પર સ્વાસ્થ્ય માટે સરળ ટ્રિક્સ આપ્રાવો, માનસિક સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

નવી દિલ્હી,

સ્પોર્ટ્સ ડે પર, જાણો કેવી રીતે રમતો માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. માનસિક સ્વાસ્થ્ય માટે કસરતના ફાયદા શું છે? શારીરિક પ્રવૃત્તિઓ (શારીરિક પ્રવૃત્તિ અને માનસિક સ્વાસ્થ્ય સુખાકારી) વ્યક્તિના મન તેમજ તેના શરીરને મજબૂત બનાવે છે. શારીરિક પ્રવૃત્તિ માનસિક સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે (માનસિક સ્વાસ્થ્ય પર શારીરિક પ્રવૃત્તિની અસર). વ્યાયામ અને મગજ વચ્ચે ઊંડો સંબંધ છે. નિયમિતપણે શારીરિક પ્રવૃત્તિ કરવાથી મગજમાં એક રસાયણ નીકળે છે, જે મૂડને સુધારે છે. તેનાથી એકાગ્રતા વધે છે અને ઊંઘમાં સુધારો થાય છે. જો કે વધુ શારીરિક પ્રવૃત્તિની જરૂર નથી, માત્ર ચાલવા જેવી સરળ શારીરિક પ્રવૃત્તિ માનસિક સ્વાસ્થ્ય માટે વરદાન છે. શારીરિક પ્રવૃત્તિ માટે, તમે પાર્કમાં જઈ શકો છો, જ્યાં ફૂલો, વૃક્ષો, છોડ અને હરિયાળી હોય, તે વધુ ફાયદાકારક હોઈ શકે છે. જો તમે કુદરતી વાતાવરણમાં સમય પસાર કરશો તો માનસિક સ્વાસ્થ્ય સુધરી શકે છે. ડિપ્રેશન અને તણાવની સમસ્યાઓ દૂર થશે.

કેટલાક ખાસ સંજોગોમાં, ઘણા લોકો શારીરિક પ્રવૃત્તિ કરવામાં અસમર્થ હોય છે, તેથી આવા લોકો શારીરિક પ્રવૃત્તિઓ કરવા માટે તેમના ટ્રેનર પાસેથી યોગ્ય માર્ગદર્શન અથવા મદદ લઈ શકે છે. શારીરિક પ્રવૃત્તિ માટે, તમે તમારી પસંદગી અને ક્ષમતા અનુસાર વોકિંગ, યોગ અથવા વેઈટ લિફ્ટિંગ કરી શકો છો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, તમે અઠવાડિયામાં ૧૫૦ મિનિટની સામાન્ય પ્રવૃત્તિઓ અથવા ૭૫ મિનિટની સખત પ્રવૃત્તિઓનું લક્ષ્ય નક્કી કરીને તેને પૂર્ણ કરી શકો છો. નિયમિત વ્યાયામ શરીરને સ્વસ્થ રાખે છે અને સારા માનસિક સ્વાસ્થ્ય માટે પણ એક ઉત્તમ ઉપાય છે. વ્યાયામ ડિપ્રેશન, ચિંતા, તણાવ તેમજ એડીએચડીના લક્ષણોથી રાહત આપે છે. ઊંઘની ગુણવત્તા અને મૂડ સારો છે. શારીરિક રીતે ફિટ અને માનસિક રીતે સ્વસ્થ રહેવામાં વ્યાયામ મહત્વનો ભાગ ભજવે છે. નિયમિતપણે શારીરિક પ્રવૃત્તિ કરવાથી ડાયાબિટીસ, હૃદય રોગની સાથે-સાથે સ્થૂળતા જેવી સમસ્યાઓ પણ ઓછી થવા લાગે છે. રોગપ્રતિકારક શક્તિ વધે છે.

અગ્રપ્રાશન, સગર્ભા, ધાત્રી માતા અને કિશોરીઓને પોષણ બાસ્કેટ વિતરણ પણ કરાયું

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૭મા રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૪નો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ ગાંધીનગર મહાત્મા મંદિરથી કરાવ્યો હતો. આ અવસરે મહાનુભાવોના વરદહસ્તે અગ્રપ્રાશન, સગર્ભા, ધાત્રી માતા અને કિશોરીઓને પોષણ બાસ્કેટ વિતરણની સાથે વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

સ્વસ્થ ભારતના નિર્માણની દિશામાં દેશની મહિલાઓ અને બાળકોમાં પોષણને સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮થી દર વર્ષે ભારતભરમાં સપ્ટેમ્બર માસને ×રાષ્ટ્રીય પોષણ માહ× તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ તા. ૧ થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન દેશભરમાં સાતમાં ×રાષ્ટ્રીય પોષણ માહ×ની ઉજવણી કરવામાં આવશે.

ક્રિસ્તાનને ચેમ્પિયન્સ ઓફ ચેમ્પિયન કરવા

ચેરમેન પાકિસ્તાનક્રિકેટ કંટ્રોલ બોર્ડને(લવ)લેટર

પ્રિય મોહસીન નકવીજી,

ચેરમેન,
પાકિસ્તાન ક્રિકેટ કંટ્રોલ બોર્ડ
લાહોર-પાકિસ્તાન
સલામ વાલેકુમ.

ભારતથી અખડજંતર ચેનલ કે ટે દેશની નંબરવન નવરીધૂપ ચેનલ છે તેના ચિપ રિપોર્ટર ગિરધરલાલ ગરબડિયા અને રાજુ રદી કેમેરામેનના જયહિન્દ વાંચશોજી.

તમને પ્રિય તરીકે સંબોધન કરવું અમારા માટે ખતરોથી ખાલી નથી. જો કે, અમે ખતરોના અનાડી ખેલાડી છીએ અમે તો અજમલ કસાબ કે અફજલ ગુરુની પાછળ માનાર્થે જી ‘ નું પૂંછડું લગાડીએ છીએ .તકવાદી હોય કે આતંકવાદી અમારી નજરમાં સૌ કોઈ સન્માનના સંપૂર્ણ હકદાર છે!

નકવી સાહેબ,પીસીબી એટલે કે પાકિસ્તાન ક્રિકેટ કંટ્રોલ બોર્ડની સ્થાપના થઈ ત્યારથી તમે ૩૭ મા ચેરમેન બન્યા છો.તમારી સિવાય પીસીબીના ચેરમેન તરીકે પાકિસ્તાન લશ્કરના અધિકારીઓએ ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ તરીકે કામ કરેલ છે. પાકિસ્તાનની પ્રજા સતોતેર વરસોની આઝાદી દરમિયાન મહદઅંશે લશ્કરના લોખંડી બૂટની એડી નીચે સિગારેટના ઠુંઠાની જેમ કચડાયેલ છે. આવું જ પીસીબી સાથે બન્યું છે.

ક્રિકેટમાં ખેલાડીએ સફળ થવા કઠોર પરિશ્રમ કરવો પડે છે. અમારા સ્ટાર ક્રિકેટરો નેટ પ્રેક્ટિસમાં એટલો પરસેવો વહેડાવે છે કે ખારા પરસેવાનો પ્રશાંત મહાસાગર રચી નાંખે છે.(ગિરધરલાલ દરિયો ખારો અને ખોરો હોય. ક્યાંય મીઠો મહાસાગર જોયો? મહાસાગર લખ્યું તો ખારો લખવાની કોઈ જરૂર ખરી?) પરંતુ, રિયલ મેચમાં પહેલા બોલે ડાંડિયા ડૂલ થઈ જાય છે એ વાત અલગ છે! કેમ કે ,રિયલ મેચમાં શેરી ક્રિકેટની જેમ ટ્રાયલ બોલ,થુપ્પીસ કે ટેમ્પલીઝ હોતું નથી, એની

ક્રિકેટાયણ છે.

બાણવાળી અર્જુનની જેમ સારા ક્રિકેટર થવા માટે બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગ પર લક્ષ કેન્દ્રિત કરવું પડે છે. જો બેટસમેન ઉત્તમ હોય,પરંતુ, ફિલ્ડિંગ ગરનાળા કરતો હોય એટલે લોચા મારે તો તેની કેરિયરનું અચ્યુતમ્ કેશવમ્ થઈ જાય. સારો બોલર શ્રેષ્ઠ બોલિંગ કરી વિકેટ ખેરવે પણ કેચ ડ્રોપ કરે તો તેની કેરિયર સમાપ્ત થઈ જાય. કેચિસ વિન મેચિસ કહેવાય છે. જો કેચ પકડવામાં લોચા મારવામાં આવે તો મેચ હારવાની નોખત આવે.ક્યારેક મોટા સ્કોરને ચેજ કરતા ક્રિકેટરે મગજ કોલ્ડ સ્ટોરેજ જેવું ઠંડુંગાર કરી બેટિંગ કરવું પડે. ચોગ્ગા છગ્ગા લેવાની લાયકામાં ગલોળા ચડાવવા કરતા એકબે રન લઈ સ્કોરબોર્ડનું પાટિયું ફરતું રાખવું પડે. ટેસ્ટ મેચ, વન ડે કે ટવેન્ટી ટવેન્ટી મેચમાં બેટિંગ જરૂરિયાત મુજબ ફાસ્ટ કે સ્લો કરવું પડે. ટવેન્ટી ટવેન્ટી મેચમાં ટેસ્ટ મેચની જેમ ઠીચૂક ઠીચૂક બેટિંગ કરવાથી હારના કોફિનમાં ખીલો ખોડવાનો જ બાકી રહે!

ક્રિકેટર હીટ, ફીટ અને ચુસ્ત રહેવા માટે રમ્બો, ફૂટબોલ , વેઈટ લિફ્ટિંગ બોક્સિંગ સાયકલિંગ જેવી રમતો રમે છે. વછેરા જેવા ખેલાડી સચિન કે વિરાટ બનવા માટે ક્રિકેટ કોચિંગ એકેડેમી, વર્કશોપ, શિબિરમાં ટ્રેનિંગ લે છે. બેટિંગ સુદ્રઢ કરવા હેવી બેટથી પ્રેક્ટિસ કરવી,ભારે દડાથી પ્રેક્ટિસ કરવી,વર્કઆઉટ કરવા વગેરે કરે છે. બોલને હથેળીમાં પકડી રાખે છે, બોલને સ્કવિઝ કરે છે.હાથને મજબૂત કરવા બાયશોપ કરે છે,હથોડા વીઝે છે,પુલઅપ કરે છે,ડ્રિલ કરે છે. ફિલ્ડિંગ માટે કેચ કરવા, વિકેટ પર શ્રો કરવા વગેરેની પ્રેક્ટિસ કરવી પડે છે. ટેબ્લેટ લઈને કે ઈન્જેકશન લગાવીને સફળ ક્રિકેટર થઈ શકાતુ હોય તો અમારો રાજુ રદી સ્ટાર ક્રિકેટર થઈ ગયા હોત!

બેટસમેન તરીકે તમારે બેકફૂટ જઈ કે ફ્રન્ટફૂટ પર હૂક મારવો કે બોલને લોકફટ કરી સિક્સર કે ફોર મારવી હોય તો સલીમ દુકાની , વિવિયન રિચાર્ડસ કે ક્રિસ ગેઈલની બેટિંગ ટેકનિકનો , ખામી, ખૂબીનો અભ્યાસ કરવો જોઈએ. મોહિન્દર અમરનાથ બોલને

સિક્સ ફટકારવાના પ્રયાસમાં હિટ વિકેટ થઈ જતા હતા.

ફિલ્ડર તરીકે બોલ પર ચિતાની જેમ લપકવા માટે દક્ષિણ આફ્રિકાના અફલાતૂન ફિલ્ડર જહોન્ટી રોડજના વિઝયુએલ્સનો સ્ટડી કરવો પડે. નહિંતર ફિલ્ડિંગમાં લોચાલાપશી યાવચચંદ્રોદિવાકરો છે જ! ફાસ્ટ બોલર તરીકે સ્થાપિત થવા જેફ થોમ્સન, એલન ડોનાલ્ડ, ઈમરાનખાન કે ગ્લેન મેકગ્રાથની ઈનફિંગ-આઈટરિંગ, યોર્કર, બાઉન્સરનો અભ્યાસ કરવો પડે. હવેની પિચ બોલરની કબર જેવી અને બેટસમેનના સ્વર્ગ જેવી બને છે.પરિણામે તનતોડ બોલિંગ કરતા બોલરો જુડાય ત્યારે તેની સ્થિતિ દયનીય થઈ જાય છે. ક્રિકેટનું લેવલ સુધારવા બેટિંગ કોચ, બોલિંગ કોચ, ફિલ્ડિંગ કોચ, ફિઝિયો, મેન્ટર, વગેરે પ્રકારના બેસ્ટ કોચ દ્વારા સઘન પ્રશિક્ષણ આપવું પડે, ક્રિકેટરમાં કિલિંગ ઈનિસ્ટિંકટ હોવી જોઈએ અને જીતવાની પ્રબળતમ ભૂખ હોવી જોઈએ. ક્રિકેટ ટીમ ગેમમાં છે. વ્યક્તિગત હિટ કે રેકર્ડ ગોણ છે. ભાઈ જાન, તમે તો કમાલ કરી દીધી. ક્રિકેટની કાચાકલ્પ કરવાની લ્હાયમાં ક્રિકેટની કમર તોડી નાંખી. પાકિસ્તાનના ક્રિકેટનું સ્તર પાતાળમાં ગયું છે. અલબત્ત, પાકિસ્તાનના ક્રિકેટનું સ્તર હતું કે કેમ તેવો સવાલ અમારો રાજુ રદી ઉઠાવે છે. પાકિસ્તાન અગિયાર ખેલાડી ઉપરાંત અમ્પાયર નામના બારમા ખેલાડી સાથે ક્રિકેટ રમે છે તેમ કહેવાય છે.પાકિસ્તાની ક્રિકેટમાં મેચ ફિક્સિંગ નામનો બાઉન્સર હંમેશા હવામાં તરતો રહે છે.

ભાઈજાન, તમે ટીમની ટ્રેનિંગ કોની પાસે કરાવી? ભારતીય લશ્કરે અનેકવાર જેમના છોતરા કાઢ્યા છે અને ફિફા ખંડાવેલ છે તેવી પાક મિલિટરી પાસે એની પાસે ક્રિકેટની તાલીમ? ફિદાઈન હુમલા કરવાના હોય, પ્રોક્સી વોર કરવાનું હોય, પોલિટિકલ લિડરની ગેમ બજાવવાની હોય, આવામ પર સિતમ બજાવવાનો હોય, કરોડાના સ્કેમ કરવાના હોય તો આર્મી ચાલે ! ક્રિકેટની તાલીમ એ પણ બદનામ પાક આર્મી પાસેથી ? અતીતમાં આવી ટ્રેનિંગ લીધા પછી પાક ક્રિકેટની હાલત દાળ જેવી પતલી થયેલી એ તમે જાણતા ન હતા? યેહ મુંહ ઔર મસૂરકી દાલ જેવો ઘાટ. કુંડું કથરોટને જોઈને હસે તેવો ખેલ થયો.

સુપર લીગ દરમિયાન મોટા શોટ્સ ના ફટકારી શકવા બદલ ખેલાડીઓને તમે આડેહાથ લીધા હતા. સુપર લીગ સમાપ્ત થતાંની સાથે જ પાક ક્રિકેટરોને ૧૪ દિવસની તાલીમ માટે તમે કાકુલની પાક મિલિટરી એકેડેમીમાં મોકલેલ. પર્વતો પર ચઢાણ અને પથ્થર ઉપાડવા જેવી કઠોર તાલીમ આપવામાં આવેલ. લશ્કરી તાલીમ દરમિયાન કાકુલના પર્વતો પર ક્રિકેટરોને એકબીજાની પીઠ પર બેસાડી દોડાવી રહ્યા છે. આ સાથે આર્મી ફિઝિકલ હર્ડલ, બર્મા બ્રિજ અને કલાઈમ્બિંગ પણ કરાવાય છે. સૌથી અઘરી કવાયત ખેલાડીઓને એકબીજાની પીઠ પર બેસાડીને દોડવું છે. જેમ એક સૈનિક યુદ્ધના મેદાનમાં તેના ઘાયલ સાથીને પીઠ પર ઉઠાવીને દોડે છે. જેમાં ઘણા ખેલાડીઓ હાંફી રહ્યા છે.તમે સૈનિક અને ખેલાડી વચ્ચેનો તફાવત ભૂલી ગયા છો તેવો પણ આક્ષેપ થાય છે.

નકવી સાહેબ તમે, દરેક મર્જની દવા લશ્કરને માનો છો તેમાં તમારા દેશમાં શાસન મોટાભાગે લશ્કરી શાસન રહ્યું છે તેનું પરિણામ છે. આ બધી ભોડાકૂટ કરવા કરતા તમે એક કામ ન કરી શકો? તમારા લશ્કરના મેજર જનરલ, કર્નલ,બ્રિગેડિયર, એર માર્શલ, ચીફ ઓફ થી સ્ટાફ, આઉએસઆઈ ચીફ, તાલિબાન કમાન્ડરને જ ક્રિકેટની ટીમમાં સમાવી લો. એમને ફાયરિંગ કરતા મિસફાયરિંગનો અનુભવ છે એકે-૪૭ને બદલે બેટ પકડાવી દો, બોમ્બને બદલે બોલ પકડાવી દો. પછી કમાલ જુવો. પાકિસ્તાન ક્રિકેટ ટીમ ટેસ્ટ, વનડે અને ટવેન્ટી ટવેન્ટી એમ ત્રણેય ફોર્મેટના ચેમ્પિયનસ ઓફ ધી ચેમ્પિયન ન બંને તો અમારું નામ ગિરધરલાલમાથી બદલીને ગિરધરલાલ કરી નાંખજો. જે ક્રિકેટર કમ આર્મી ઓફિસરનું પરફોર્મન્સ પુઅર હોય તેમને કોર્ટ માર્શલ કરી ફાંસીએ ચડાવવાની સહિલવિયત પણ રહેશે! બેગમબચ્ચા સલામત રહે તેવી દુવા. ખુદાહાફિજ. વિભિંતંગ ગિરધરલાલ અને રાજુ રદીના જય ક્રિકેટ !



NOG SS NO 370

વિષય:- "બંધન છૂટે ના"

શીર્ષક :- "બંધન છૂટે ના"

પ્રકાર :- પદ્ય. શબ્દો :- ૮૫

આ કેવું છે બંધન, મુક્તિ માંગે ના,
દૃઢચિત્ત રહી સદા તું, બંધન છૂટે ના.

સદા હસતી રહે તું મારા અશ્રુ મહી,
દૂર ભલેને હોય તું મુજથી, બંધન છૂટે ના.

નીરખે નૈન મારાં તુજને મુજ સમીપે,
અંતર માપ્યું ના મપાય, બંધન છૂટે ના.

નાનપણના તારા સંગ ખેલેલા ખેલ,
યાદ હજી મુજને બધા, બંધન છૂટે ના.

થઈ ગઈ મારી દુનિયાથી ક્યાં દૂર તું,
સાથ તારાનું સ્મરણ સદા, બંધન છૂટે ના.

બહેના મારી કેમ તું રીસાણી મારાથી,
સ્વર્ગે જઈ બિરાજી તું પણ, બંધન છૂટે ના.

કહે "મહેક" સંબંધ યુગોયુગોનો આપણો.
પળવારમાં ગઈ તોડી તું પણ, બંધન છૂટે ના.

ચંદન સોલંકી "મહેક" અમદાવાદ.

NOG SS NO. 0101

વિષય : બંધન છૂટે ના.

★ શીર્ષક : ન છૂટી શકે તેવું કૌટુંબિક બંધન ★

પ્રકાર : ગદ્ય લેખ શબ્દો : ૩૩૨

જીવનમાં આપણે જે સંબંધો બનાવીએ છીએ તે બેધારી તલવાર હોઈ શકે છે. એક તરફ, તેઓ આપણામાં આનંદ, આરામ અને સમજણની ભાવના લાવે છે. બીજી બાજુ, સંબંધોનું વળગણ આપણને પાછા પાડી શકે છે, આપણને આગળ વધતા અટકાવી શકે છે.

બંધનો સંબંધો અને સંપત્તિથી લઈને વિચારો અને માન્યતાઓ સુધીના ઘણા સ્વરૂપો લઈ શકે છે. આપણે એવી વસ્તુઓ સાથે જોડાયેલા બનીએ છીએ જે આપણને સુખ, સુરક્ષા અને ઓળખની ભાવના આપે છે. જો કે, જ્યારે આપણે ખૂબ જોડાયેલા હોઈએ છીએ, ત્યારે આપણે ખરેખર મહત્વનું શું છે તેની દૃષ્ટિ ગુમાવી શકીએ છીએ.

બંધનો દુઃખ અને અસ્થિરતા તરફ દોરી શકે છે. જ્યારે આપણે કોઈ વસ્તુ સાથે ખૂબ જોડાયેલા હોઈએ છીએ, ત્યારે આપણને તેને ગુમાવવાનો ડર વધુ લાગે છે, આપણે બેચેન અને તણાવગ્રસ્ત બનીએ છીએ. આપણે ભૂલી જઈએ છીએ કે જીવનની દરેક વસ્તુ અસ્થાયી છે, આપણા સહિત.

સંબંધોના બંધનોમાં સૌથી મજબૂત બંધન છે કુટુંબનું - ફેમિલીનું.

કુટુંબનું બંધન જે સામાન્ય રીતે છૂટી નથી શકતું. પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ કુટુંબનું બંધન અચળ રહે છે. તોફાની સમુદ્રમાં લંગરની જેમ, તે સલામતી અને સ્થિરતાની ભાવના પ્રદાન કરીને, પકડી રાખે છે. પ્રિયજનો વચ્ચેનું જોડાણ એ એક શક્તિશાળી શક્તિ છે, જે સમયના સૌથી અશાંત સમયે પણ જીવન નાવને સ્થિર રાખી શકે છે.

આ બંધન જ માતા-પિતાને તેમના બાળક માટે મદદ મેળવવા, તેમને પુનઃપ્રાપ્તિની લાંબી અને મુશ્કેલ મુસાફરીમાં મદદ કરવા માટે પ્રેરિત કરે છે. આ બંધન જ ભાઈ-બહેનને તેમના ભાઈ કે બહેનની પડખે ઊભા રહેવાની શક્તિ આપે છે, ભલે આગળનો રસ્તો અનિશ્ચિત લાગે. આ ફેમિલી બોન્ડ છે જે પરિવારને એકસાથે રાખે છે, એક સતત રીમાઈન્ડર કે તેઓ તેમના સંઘર્ષમાં એકલા નથી.

વ્યસન સામેની લડાઈમાં, કૌટુંબિક બંધન એ એક શક્તિશાળી શસ્ત્ર છે. તે આશાનો સ્ત્રોત છે, એક રીમાઈન્ડર છે કે આગળનો માર્ગ હંમેશા હોય છે, પછી ભલે વર્તમાન ગમે તેટલો અંધકારમય લાગે. તે પ્રેમની સ્થાયી શક્તિનો પુરાવો છે, એક એવો પ્રેમ કે જે પડકારોની સૌથી ભયાવહ સ્થિતિ પણ જીતી શકે છે.

તો ચાલો આપણે આ બંધનને વળગી રહીએ, તેનું જતન કરીએ અને તેને પકડી રાખીએ. કારણ કે અંતે, તે કુટુંબનું બંધન છે જે આપણને જોશે, આપણને સતત યાદ અપાવ્યા કરે છે કે આપણે ક્યારેય એકલા નથી.

ભરત સાંગાણી

NOG SS No-106

વિષય-બંધન છૂટે ના

શીર્ષક-"મોહ"

શબ્દ-૩૦૬

મીરા,નરસિંહ, શકુબાઈ,પાનબાઈ!

ની વાતોનો એક જ ધ્વનિ છે,"આ બધું જ નાશવંત છે-ક્ષણિક છે" પૈસો કમાવો જરૂરી છે જ, સાચું કે પૈસો એ જીવનનો એક અનિવાર્ય અંગ છે,એ કમાવવા માટે ખુદનું જીવન,જીવનની શાંતિ ખતમ થઈ જાય એ હદે જવું,એ તો એક જાતના "શાંતિના આપઘાત" બરાબરની વાત થઈ...!

એક ભાઈ હતા.એમને દાળિયા ખરીદવા હતા.તે બજારમાં ગયા.ત્યાં ગુજરી ભરાણી હતી. એટલે આખું એક વર્તુળાકારમાં દુકાનોનું બજાર હતું.તેમને જાણવા મળ્યું કે,આગળ જશો,તો દાળિયા સાથે સેવ મફતમાં મળશે.ત્યાં પહોંચ્યા તો કોઈએ કહ્યું કે આગળ જાવ ત્યાં 'સેવ-મમરા અને બુંદી' પણ દાળિયા સાથે મફતમાં મળે છે!

"મફત મફત મફત"માટે ભાઈ તો આગળ વધતા જ રહ્યા. છેવટે શું થયું? બધું જ ખતમ થઈ ગયું હતું!અને જ્યાંથી આવેલા એ દુકાનો પણ બંધ થઈ ગયેલી.

સસ્તું મળવાના લોભમાં ભાઈ દાળિયાથી પણ રહ્યા! હકીકતમાં 'મળ્યું છે, તે માણવાનું ભૂલાઈ જાય!' અને એના બદલે, ભવિષ્ય માટે વિચારના થઈ જઈએ! આતો એની મિલકત ઉપર,'સાપની જેમ બેસશે' એટલી હદે કે પૈસા પાછળ "આપઘાત" કરે. ફિલ્મ સિતારાઓનું જીવન એનું જવલંત ઉદાહરણ છે. હા!સૂકો રોટલો ખાતાં હો,અને ઘીવાળો રોટલો ખાવા મળે,મજા તો આવેજ.જિંદગીમાં ઊંચું જોવાની અને સારું મેળવવાની કોશીશ તો કરવી જ જોઈએ,પણ એટલી હદે નહિ કે વર્તમાન "ભૂત" બની જાય.

રણમાં ઝાંઝવાનાં જળની જેમ,જિંદગીની આશા,આકાંક્ષા,અપેક્ષા પાછળ ભાગીએ છીએ.

અને કર્મનાં બંધનોથી બંધાતાં જઈએ છીએ!

ભરતમુનિની સાધના ખુલતાં,એમણે મૃગલીની પ્રસવવેદના જોઈ સહન ના થઈ!પરંતુ નવાં જન્મેલાં હરણનાં બચ્ચાંથી,એવાતો આકર્ષાયા કે બીજો જન્મ લેવો પડ્યો!

ફક્ત વિચારોથી મોહ પામીએ છીએ, જન્મોનાં, કર્મનાં બંધનોથી બંધાતાં જ રહીએ છીએ!

આંખોથી જોયેલી વસ્તુ ઉપર એવો મોહ થઈ જાય કે એના ઉપર અધિકાર જમાવવા કોશીશ કરીએ!

પણ ખરેખર કામ, કોધ,લોભ,મદ,મોહ, ઈર્ષ્યાના ચકાવામાંથી બહાર નીકળવું હોય તો ★મોહ★

મને જોઈએ,મારું છે, મારું-મારું-મારું-ના

ચક્રરમાંથી છૂટવું પડશે!

મુક્તિદા કુમાર 'રુપલી'

NOG SS NO - 191

પ્રકાર - પદ્ય શબ્દ : ૧૩૮

વિષય : બંધન છૂટે ના...

શીર્ષક : કફન જરૂરી નથી.....

જિંદગીના હરેક રિશતામાં બંધન જરૂરી નથી, સાપનો સ્વભાવ બદલવા ચંદન જરૂરી નથી.

સહનશીલ ની જ શક્તિ છવાય છે સંતાપમાં, આંસુ પી જાઓ મુંગા મોઢે, રૂદન જરૂરી નથી.

સમસ્યાઓ તો નાચશે સર પર ચડી ચડી ને, ચિંતા છોડો ચમત્કાર કરો, ચિંતન જરૂરી નથી.

સદગુરુ મળે તો સાષ્ટાંગ કરો ભક્તિ ભાવથી, સાધુવેષ માં ફરતા શૈતાન ને વંદન જરૂરી નથી.

નિષ્ફળતા પણ એક ભાગ છે જિંદગીનો ભાઈ, એના માટે કોઈ ગહન કે ઊંડું મંથન જરૂરી નથી.

દુનિયામાં બધુ આપણે માનીએ એવું હોતુ નથી, માનવું હોય તો માનો,માન્યતાનું ખંડન જરૂરી નથી.

જિંદગી આખી હિર ચિર પહેર્યા તો પણ શું મળ્યું, મિત્ર મોત જો ઈજજતનું મળે તો કફન જરૂરી નથી.

વિનોદ સોલંકી "મિત્ર" લખતર.

NOG:SS:NO. : 142

વિષય : બંધન છૂટે ના

શીર્ષક : બંધાવું કોને ગમે!?

શબ્દો : ૪૮

બાંધે અહીં સૌ કોઈને, બંધાવું કોને ગમે!?

ચિરવા બેઠી દુનિયા, સંધાવું કોને ગમે!?

પરતાપણે શેકે રોટલા,પોતાનાજ સૌ કોઈ,

હળી-મળીને ભળી સૌમાં, રંધાવું કોને ગમે!?

કમાવા મોટી નામના, ભેરુના ગળા દાબે,

બદનામીની વાસથી, ગંધાવું કોને ગમે!?

શબ્દોના ભાલા ભારે, "શૈલ" હેથે ભોકે,

ચીંધે સૌ કોઈ અહીં, વિંધાવું કોને ગમે!?

શૈલેષ ભોઈ "શૈલ"

NOG SS NO 223

વિષય :- "બંધન તૂટે ના"

શીર્ષક :- નિત્ય અદ્વૈત

પ્રકાર :- પદ્ય - શબ્દ :- ૮૩

આ તરસી ધરતીને વિરહ વેદના,

વાદળોનું બંધન તૂટે ના.

આ લખચોરાશીમાં ફરે જીવ,

પણ શિવ સ્મરણ બંધન તૂટે ના.

આ જન્મે ઋણાનુંબંધે મળ્યા સર્વ મને,

તવ નિર્મલ

આભાર - નિહારીકા રવિયા સ્નેહ બંધન તૂટે ના.

જન્મોજન્મ રહ્યા સાથે,

હવે આ જન્મે એ બંધન તૂટે ના.

સરિતાનું હિમ શિખરેથી આવવું,

સાગર સાથ બંધન તૂટે ના.

સંસાર અનિત્ય ક્ષણિક દ્વૈત સર્વ,

સનાતન અદ્વૈત બંધન તૂટે ના.

નામ : દેવેન્દ્ર આચાર્ય

NOG SS NO 349

વિષય :- 'બંધન તૂટે ના'

શીર્ષક :- અનોખું બંધન

પ્રકાર :-પદ્ય. શબ્દ:-૧૦૦

તારી સાથે મારી લાગણીઓ બંધાઈ ગઈ છે,
તારી સામે મારાથી બધી વાતો કહેવાઈ ગઈ છે...

બાકી તો બધું છોડવાં લાગ્યો છું હું ધીમે ધીમે,
ખબર નહીં કેવી રીત તારી આદત થઈ ગઈ છે...

તારું અને મારું આ બંધન છુટે ના કોઈ દિવસ,
થોડાં સમયમાં તારી સંગ પ્રિત જોડાઈ ગઈ છે...

ગમે એવી તકરારમાં આ અનોખું બંધન ના તૂટે,
તારાં આવવાથી મારી જિંદગી બદલાઈ ગઈ છે...

શું કહું તને બીજું તારાં વગર જિંદગી શક્ય નથી,
તું સંગ હોય તો મુશ્કેલ ઘડી હસતાં વિતી ગઈ છે...

ના આ બંધન છૂટે ,ના તારી યાદો ભૂલાય મારાથી,
તારાં સંગ જન્મોજન્મની લાગણી બંધાઈ ગઈ છે...

નામ:-જગડ ભાર્ગવ

NOG S S NO 163

પ્રકાર:પદ્ય શબ્દ : ૮૦

વિષય : બંધન છૂટે ના...

શીર્ષક :બંધન

બંધન..

વાત વાતમાં આપણ બંને,

આવી ગયાં નિકટ..

વિચારોના આદાનપ્રદાનથી

મંજિલ મળી બે હેયાને..

બંધાઈ ગઈ તુજ બંધનમાં!

બંધન તારું લાગે વ્હાલું..

હવે

પ્રીત ની રીત નિભાવશું,

પાર કરીશું જીવન નૈયા..

પ્રીતનું બંધન છૂટે ના..

પ્રેમ અને વિશ્વાસની સાથે!

સુખ દુઃખ આપણે વહેંચીશું..

બંધનમાં બંધાઈને પ્રિયવર,

પ્રીતિની રીત નિભાવશું..

પ્રભુ બંધન છૂટે ના..

શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી,

'મૌની' વડોદરા

Mog SS No : 343

વિષય : બંધન છૂટે ના

શીર્ષક : સંબંધ નાં બંધન

પ્રકાર : પદ્ય. શબ્દો : ૬૫

અવતરણથી જીવનપંથ માં માનવ હોય સજીવન,

એકબીજા પ્રત્યે હેત પ્રેમ વહાવી રચે છે અતૂટ

બંધન,

સ્નેહ સિંચન થી જે બને લાગણી નો મીઠો સંબંધ,

સ્વાર્થ માટે પ્રપંચ રચી ઉદભવે હેથે જ્યારે મનોમંથન,

લાગણી હેત પ્રેમ મમત્વ સ્નેહ ગુમાવી બને

હવે બીનસંવેદન,

આશા આકાંક્ષા પૂર્ણ કરવા લાગણી સામે જીતી બને

નિર્જીવ,

"ચંદ્ર" સૂર્ય ઉદય અસ્ત ની રમત રમતાં એકબીજા પર છે

અવલંબન,

જે ઉદાહરણીય પંથે ચાલશો તો નિર્જીવ બંધન થી થશે

સંબંધ સજીવન.

?? " ચંદ્ર " ચંદ્રકાન્ત હરીલાલ માઠક

(નીવૃત પોલીસ સબ ઈન્સ.) રાજકોટ



દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા શરૂ કરેલ "નિર્મળ ગુજરાત" અભિયાનને આગળ ધપાવતા માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા સ્વચ્છ રાજ્યના નિર્માણની નેમ વ્યક્ત કરતા "નિર્મળ ગુજરાત ૨.૦" લોન્ચ કરવામાં આવેલ છે. જે અંતર્ગત આજે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા રાંધેજ ખાતે સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મેયરશ્રી મીરાબેન પટેલ સફાઈ માં જોડાઈને જણાવ્યું હતું કે આવો, આપણે સૌ સાથે મળી સ્વચ્છ ભારતની સંકલ્પના સાકાર કરીએ.

બોટાદ નગરપાલિકા તથા જાયન્ટ્સ ગ્રૂપ ઓફ બોટાદ દ્વારા સંચાલિત નાઈટ શેલ્ટર હોમની કેબિનેટ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ મુલાકાત લીધી

ભાવેશ પરમાર: બોટાદ

આજરોજ તારીખ ૨૯ ૮

૨૦૨૪ ના રોજ બોટાદ

નગરપાલિકા તેમજ જાયન્ટ્સ ગ્રુપ

ઓફ બોટાદ સંચાલિત નાઈટ

શેલ્ટર હોમમા છેલ્લા પાંચ દિવસથી

વરસતા સતત વરસાદના લીધે

બોટાદ ની અંદર રહેતા ઘરવિહોણા

તેમજ જેમને રહેવા માટેની

સગવડતા નથી તેવા લોકો માટેનો

આશરો એટલે સેલ્ટર હોમની

મુલાકાત લેતા કેબિનેટ મંત્રી શ્રી

ભાનુબેન બાબરીયા. મુલાકાત

દરમિયાન ઘરવિહોણા લોકો ત્યાં

હાજર હોય તે લોકો માટે બપોરે



તેમ જ સાંજે જમવાની વ્યવસ્થા તેમજ રહેવા માટેની ઉત્તમ સગવડ જોઈ કેબિનેટ મંત્રી ખૂબ જ પ્રસન્નતા અનુભવી હતી તેમની મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રી જેન્સી રોય મેડમ, ડીડીઓશ્રી બુડાનીયા સાહેબ ,એસ.પી.શ્રી બારોલીયા સાહેબ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જેડીબેન પરમાર શુપ પ્રમુખ શ્રી ચંદુભાઈ સાવલિયા, ફેડરેશન પ્રમુખ કેતનભાઈ રોજેશરા, કલ્પેશભાઈ ગાંધી, હરેશભાઈ પીઠવા તેમજ શુપના મેમ્બરો તથા વિવિધ અધિકારીઓ હાજર રહી સેન્ટર હોમ ની મુલાકાત લઈ પ્રસન્નતા વ્યક્ત કરેલ.

૭મા 'રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૪' નો ગાંધીનગરથી રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ



મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ૭મા રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૪નો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ ગાંધીનગરથી કરાવતા સ્વપ્નપૂર્ણ જણાવ્યું કે રાષ્ટ્રીય પોષણ અભિયાન માતા અને બાળ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આપી ઈકોસિસ્ટમમાં બદલાવનો નવતર અભિગમ બન્યું છે. મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, 'સહી પોષણ-દેશ રોશન'ના ધ્યેય સાથે માતા અને બાળકના સુપોષણ અને સ્વાસ્થ્ય તંદુરસ્તીથી વિકસિત ભારતજર ૨૦૪૭નો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ સાકાર કરવામાં પોષણ માહ મહત્વપૂર્ણ બનશે.

દેશમાં સગભાઈ સ્ત્રીઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ અને ૬ વર્ષની વય સુધીના બાળકોના પોષણની સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરીને કુપોષણ સામેના જંગ માટે વડાપ્રધાનશ્રીએ ૨૦૧૮માં રાષ્ટ્રીય પોષણ અભિયાનની શરૂઆત કરાવી હતી.

દર વર્ષે સમગ્ર સાપ્ટેમ્બર મહિનાને પોષણ માહ તરીકે ઉજવવાની આ પરંપરાની ૭મી શ્રેણીનો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં કેન્દ્રિય મહિલા બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીની પ્રેરક ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો હતો. સાતમા તબક્કાના આ પોષણ માહની ઉજવણી દેશભરમાં એનિમિયા નિવારણ, ગ્રોથ મોનિટરિંગ, ટેકનોલોજીના ઉપયોગથી સુશાસન અને પારદર્શિતા દ્વારા કાર્યક્રમ સેવા

વિતરણ, પોષણ ભી પઢાઈ ભી અને પૂરક આહારની થીમ સાથે થવાની છે.

મુખ્યમંત્રીશ્રી અને કેન્દ્રિય મહિલા બાળ કલ્યાણ મંત્રીશ્રી તેમ જ ગુજરાતના મહિલા બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરિયાએ આ અવસરે પ્રતિકરૂપે ભૂલકાંઓને અન્નપ્રાશન ટીપ્પણ પીવડાવવા સાથે, ડાહી દીકરી યોજનાના લાભાર્થીઓને લાભ વિતરણ, સગભાઈ અને ધાત્રી માતા તથા એડોલસન્ટ ટીકરીને પોષણક્ષમ આહાર ક્રીટ તેમ જ સ્વાલંબન યોજનાના લાભાર્થી બહેનને સહાય ચેકનું વિતરણ કર્યું હતું. રાજ્ય સરકારની નવી નારી ગૌરવ નીતિ-૨૦૨૪નું લોન્ચિંગ પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે આ પ્રસંગે કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, સૌના સાથે, સૌના વિકાસના મંત્રને રાષ્ટ્રવિત અભિયાનોમાં જનભાગીદારી જોડીને સાકાર કરવાની જે પ્રેરણા વડાપ્રધાનશ્રીએ આપી છે, તેના ફળસ્વરૂપે પોષણ માહ હવે કુપોષણ સામેની લડાઈનું જનઆંદોલન બની ગયું છે.

તેમણે ગુજરાતમાં માતાઓ, સગભાઈ બહેનો, એડોલસન્ટ ટીકરીઓ અને બાળકોના પોષણ, આરોગ્ય અને શિક્ષણની બાબતમાં સંકલિત અભિગમ રાજ્ય સરકારે અપનાવ્યો છે, તેની વિશદ ભૂમિકા પણ આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ અંગે જણાવ્યું કે, બાળકોનું અને ખાસ કરીને આદિજાતિ વિસ્તારોના બાળકોનું પોષણ સ્તર ઊંચું લાવવા દૂધ સંચવની યોજનામાં અંદાજે ૧૩ લાખથી વધુ બાળકોને પાશ્ચાત્ય ફોર્મ્યુલાઈડ ફ્લેવર્ડ મિલ્ક સરકાર આપે છે.

એટલું જ નહીં, ટેક હોમ રાશન, પોષણ સુધા અને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના દ્વારા વધારાનું પ્રોટીન તથા પૂરક પોષક આહાર પૂરો પાડવામાં આવે છે. આવી સર્વગ્રાહી પોષણ યોજનાઓના સકારાત્મક પરિણામો રાજ્યમાં જોવા મળ્યા છે અને અત્યાર સુધીમાં ૪૫ લાખ લાભાર્થીઓને યોજનાકીય લાભ મળ્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ દેશની માતાઓ અને બાળકોના પોષણ સાથે ધરતી માતાના પર્યાવરણીય પોષણની કળજી લઈને 'એક પેઠ મા કે નામ' અભિયાન શરૂ કરાવ્યું છે.

ગુજરાતની બધી જ પડ ઉજર આંગણવાડીઓમાં આ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ, વૃક્ષઉછેર અને જતન તથા માવજતનો આયામ સરકારે અપનાવ્યો છે, તેનો પણ તેમણે ગૌરવસહ ઉલ્લેખ કર્યો હતો

મુખ્યમંત્રીશ્રીએ સૌને સહિયારા પુરુષાર્થથી આ સાતમા પોષણ માહને સિદ્ધિની નવી ઊંચાઈઓ પાર કરાવવા આહવાન કર્યું હતું. રાષ્ટ્રીય પોષણ માહના પ્રારંભ પ્રસંગે કેન્દ્રીય મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી અન્નપૂર્ણા દેવીએ જણાવ્યું હતું કે, ભારતે આઝાદીના અમૃતકાળમાં પ્રવેશ કર્યો છે, ત્યારે વિકસિત ભારતની સિદ્ધિ માટે દેશને કુપોષણ મુક્ત બનાવવામાં પોષણ અભિયાન ખૂબ જ મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશાં મહિલાઓ તથા બાળકોના વિકાસ અને પોષણને પ્રાધાન્ય આપ્યું છે. તેમણે વડાપ્રધાનશ્રીની મન કી બાતના આ વખતનાં સંસ્કરણનો ઉલ્લેખ કરતા કહ્યું કે વડાપ્રધાનશ્રીએ રાષ્ટ્રીય પોષણ માહ વિશે કહ્યું હતું કે, દેશનાં બાળકો અને મહિલાઓને યોગ્ય પોષણ આપવું એ દેશની પ્રાથમિકતા છે.

કેન્દ્રીય મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, પોષણ અભિયાન અંતર્ગત છેલ્લા ૪ વર્ષમાં ૩.૧૭ કરોડથી વધુ સમુદાય આધારિત કાર્યક્રમો યોજાયા છે. ભારત સરકારે ૨૦૨૪-૨૫ના રાષ્ટ્રીય પોષણ માહના ઊજવણી વિવિધ થીમ આધારિત કરવાનું આયોજન કર્યું છે. જેમાં એનિમિયા, વૃદ્ધિ દેખરેખ (ગ્રોથ મોનિટરીંગ), પૂરક આહાર, પોષણ ભી પઢાઈ ભી (મ્મ), સુશાસન, પારદર્શિતા અને કાર્યક્રમ સેવા પહોંચાડવા માટે ટેકનોલોજી તથા સર્વગ્રાહી પોષણ કે જે પોષણ સાથે જોડાયેલી તમામ આવશ્યક બાબતોને આવરી લે છે. આ તમામ થીમ આધારિત વિવિધ પ્રવૃત્તિઓ આ મહિના દરમિયાન સમગ્ર દેશમાં આયોજિત કરાશે.

દેશની મહિલા સ્વસ્થ હશે, તો સંપૂર્ણ દેશ સ્વસ્થ બનશે, તેમ કહેતાં તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લાં દસ વર્ષમાં ભારત સરકારે મહિલા અને બાળલક્ષી અનેકવિધ યોજનાઓને માત્ર લાગુ જ નથી કરી, પરંતુ તેનું સુદઢ અમલીકરણ અને મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે. આ તમામ યોજનાઓનો લાભ છેવાડાના લાભાર્થી સુધી પહોંચે, તેની સરકાર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.

ગુજરાતની કામગીરીને બિરદાવતા મંત્રીશ્રી કહ્યું હતું કે, મુખ્યમંત્રી

શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ તથા મહિલા બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબહેન બાબરિયાના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પોષણલક્ષી ઉત્તમ કામગીરી થઈ રહી છે. પોષણ માસની ઉજવણીમાં ગુજરાત દર વર્ષે અગ્રેસર રહ્યું છે, આ વર્ષે પણ ગુજરાત અગ્રેસર રહેશે, તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગુજરાત સરકારે મહિલાઓની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે પણ અનેક પગલાં લીધા છે,

આભાર - નિહારીકા રવિયા તેમાંનું સૌથી સરાહનીય પગલું એટલે કે, ૧૮૧ અભયમ મહિલા હેલ્પ-લાઈન નંબર થકી અનેક મહિલાઓ સુરક્ષિત થઈ છે. ગુજરાતનું ૧૮૧ અભયમ હેલ્પ-લાઈનનું મોડલ અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ બન્યું છે, તેમ કેન્દ્રિય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના "એક પેઠ મા કે નામ" અભિયાન વિશે વાત કરતાં કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ મિશન અંતર્ગત દેશભરની ૧૪ લાખ આંગણવાડીઓમાં વૃક્ષારોપણ કરવામાં આવશે. સમગ્ર વિશ્વ આજે ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહ્યું છે, ત્યારે આ મિશન પર્યાવરણને સંતુલિત કરી ભવિષ્યને બચાવવા કારગત સાબિત થશે. કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ સચિવ શ્રી અનિલ મલિકે પોષણ ટ્રેકરના અમલીકરણમાં ગુજરાતની કામગીરીને બિરદાવી હતી. ભારત સરકાર દ્વારા પોષણ અભિયાન અંતર્ગત હાથ ધરાયેલી વિવિધ પહેલો, પ્રવૃત્તિઓ ઉપરાંત પોષણ માહ દરમિયાન યોજાનાર કાર્યક્રમોની તેમણે વિગતવાર માહિતી આપી હતી. સાથે જ તેમણે પોષણના મહત્વ અંગે પણ વિસ્તૃત સમજ આપી હતી. ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના સચિવ શ્રી રાકેશ શંકરે કાર્યક્રમમાં સૌનું શાબ્દિક સ્વાગત કરી, ગુજરાતમાં પોષણ અભિયાન અંતર્ગત થઈ રહેલી કામગીરીની વિગતવાર માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં મહેસાણાના સાંસદ શ્રી હરિભાઈ પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી મીરાબેન પટેલ, ધારાસભ્ય સર્વે શ્રી રીટાબેન પટેલ તથા શ્રી જયંતીભાઈ પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયતનાં પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, ગુજરાતનાં અજીજી કમિશનર શ્રી રાજીવકુમાર સિંહ ઉપરાંત ભારત સરકાર તેમજ ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, આંગણવાડી કાર્યકરો તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદ સિવિલ મેડિસીટીની ક્લિનિક ઇન્સ્ટીટ્યુટમાં એક જ અઠવાડિયામાં બીજુ અંગદાન

રાજ્યમાં અંગદાનની જાગૃતતા કેળવવાઈ રહી છે. હવે રાજ્યના મોટા શહેરો ઉપરાંત અંતરિયાળ અને દૂર - સુદૂરના વિસ્તારોમાંથી પણ અંગદાન થવા લાગ્યા છે. જેમા રાજ્ય સરકારના અથાક પ્રયાસો સાથે સામાજિક અને સેવાભાવી સંસ્થાઓના સિંહફાળો છે. અમદાવાદ સિવિલ મેડિસીટીની સિવિલ હોસ્પિટલ, કિડની ઈન્સ્ટીટ્યુટ અને યુ.એન.મહેતા છેલ્લા કેટલાય સમયથી અંગદાન અને અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટે ઉદાહરણરૂપ કામગીરી કરી રહી છે.

ઓગષ્ટના રોજ થયેલ અંગદાનની વિગતો જોઈએ તો , ભાવનગર જિલ્લાના પાલીતાણાના વતની ૩૦ વર્ષના હિતેશભાઈ મારુ અમદાવાદમાં તાડપત્રીના



કારખાનામાં લાંબા સમયથી કામ કરતા હતા. તા. ૨૧ ઓગષ્ટના રોજ મુસાફરી દરમિયાન માર્ગ અકસ્માતમાં માથાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી. જેથી તેઓને ઓઢવ પાતેની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા. જ્યાં સધન

સારવારના અંતે તબીબો દ્વારા તેમને બ્રેઈનડેથ જાહેર કરવામાં આવ્યા. તબીબો દ્વારા બ્રેઈનડેથ જાહેર કરતા તેમના ભાઈ - બહેન તેમજ માતા-પિતાને અંગદાન અંગેની સમજ આપવામાં આવી. અગાઉ થી તેમના પિરિવાર જ નો ને અંગદાનના સેવાકાર્ય વિશેની માહિતી હતી. જેથી જ્યારે ખાનગી હોસ્પિટલના તબીબો તેમને અંગદાન સંદર્ભે પ્રોત્સાહિત કર્યા ત્યારે ધડીનો વિલંબ કર્યા વિના સ્વજનોએ અંગદાનનો નિર્ણય કર્યો. પરિજનોના અંગદાનના નિર્ણય બાદ બ્રેઈનડેથ હિતેશભાઈ મારુને અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઈન્સ્ટીટ્યુટમાં લાવવામાં આવ્યા. અહી ઈન્સ્ટીટ્યુટના ડાયરેક્ટર અને ઈજી ગુજરાતના કન્વીનર ડૉ. પ્રાંજલ

મોદીના માર્ગદર્શન હેઠળ તેમના રીટાઈવલની પ્રક્રિયા આરંભવામાં આવી . અને સમગ્ર પ્રક્રિયાના અંતે બે કિડનીઓ, હીવર અને હૃદયનું દાન મેળવવામાં સફળતા મળી. ડૉ. પ્રાંજલ મોદીએ જણાવ્યું કે , અંગદાન એ પ્રવર્તમાન સમયમાં મહાદાન છે. આઈ. કે. ડી. આર. સી-આઈ.ટી.એસની અંદર છેલ્લા ૬ વર્ષમાં ૨૦ અંગદાતાઓના અંગોના દાન કરવામાં આવ્યા છે. જેમાં ૩૪ કિડનીઓ, ૧૮ હીવર, ૫ હૃદય અને એક પેન્ક્રીયાસ દાન મેળવવામાં સફળતા મળી છે. આગામી સમયમાં રાજ્યમાં લાઈવ ઓર્ગન ડોનેશનમાં ઘટાડો કરવા બ્રેઈનડેથ વ્યક્તિઓના ઓર્ગન ડોનેશનની તાકીદે જરૂરીયાક હોવાથી મહત્તમ લોકો આ અંગેની જાગૃતતા કેળવીને અંગદાન માટે લોકોને પ્રેરણા આપે તેવો અનુરોધ ડૉ. મોદીએ કર્યો છે.

અમદાવાદ સિવિલ બાદ હવે એ જ કેમ્પસમાં આવેલ ઈન્સ્ટીટ્યુટ(કિડની ઈન્સ્ટીટ્યુટ)માં પણ છેલ્લા અઠવાડિયામાં બે અંગદાન થયા છે. બે બ્રેઈનડેથ વ્યક્તિઓના અંગોને રીટાઈવ કરીને જરૂરીયાતમંદમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં સફળતા મળી છે. તા. ૨૮

કારખાનામાં લાંબા સમયથી કામ કરતા હતા. તા. ૨૧ ઓગષ્ટના રોજ મુસાફરી દરમિયાન માર્ગ અકસ્માતમાં માથાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી. જેથી તેઓને ઓઢવ પાતેની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા. જ્યાં સધન

કારખાનામાં લાંબા સમયથી કામ કરતા હતા. તા. ૨૧ ઓગષ્ટના રોજ મુસાફરી દરમિયાન માર્ગ અકસ્માતમાં માથાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી. જેથી તેઓને ઓઢવ પાતેની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા. જ્યાં સધન

કારખાનામાં લાંબા સમયથી કામ કરતા હતા. તા. ૨૧ ઓગષ્ટના રોજ મુસાફરી દરમિયાન માર્ગ અકસ્માતમાં માથાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી. જેથી તેઓને ઓઢવ પાતેની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા. જ્યાં સધન

ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર "વૃક્ષ કાવડ યાત્રા" યોજાઈ

મોડાસા/૨૫ ઓગસ્ટ: અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાન્તિકુંજ હરિદ્વાર પ્રેરિત વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રની જી.પી.વાય.જી. ટીમ દ્વારા છેલ્લા ૧૬૪ રવિવારથી પ્રાણવાન સન્ને અંતર્ગત વૃક્ષારોપણ ઝુંબેશ ચલાવાઈ રહેલ છે. જેમાં મોડાસાના અલગ અલગ વિસ્તારોમાં દર રવિવારે વૃક્ષારોપણ કરવામાં આવે છે. આ અભિયાનથી મોડાસા ક્ષેત્રના વિવિધ ૪૦ વિસ્તારોમાં "મારું ઘર મારું વૃક્ષ" નામે વૃક્ષારોપણ કાર્યક્રમ કાર્યક્રમ થઈ ચૂક્યા છે. જેમાં ૧૭૦૦ વૃક્ષો ને તરુપુત્ર, તરુમિત્રના ભાવ - સંકલ્પ સાથે વાવવામાં આવેલ છે. જે અંશી ટકા રોપાઓ મોટા વૃક્ષ થઈ રહેલ છે.



નારાઓથી સંદેશ આપતા રહ્યાં. શહેરના મહત્વના માર્ગો પર આ યાત્રા પસાર થઈ જેમાં માલપુર રોડ, આઈ.ટી.આઈ , પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી- શ્રીરામ મત માર્ગ, પંચજ્યોત, ગોપાલ સોસાયટી થઈ રામ પાર્ક વિસ્તારના સોમનાથ મહાદેવે સમાપન કરવામાં આવ્યું. રસ્તામાં આવતા મહાદેવ મંદિરમાં તેમજ છેલ્લે સોમનાથ મહાદેવ ગંગાજલથી જલાભિષેક તેમજ રસ્તામાં અનેક સ્થાનો પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું. રસ્તામાં આમજનતાને તરુપ્રસાદ રુપે રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું. આ યાત્રામાં યુવા ભાઈઓ બહેનો સહિત અનેક ગાયત્રી સાધકો તેમજ આમ જનતા જોડાયા. મોડાસામાં આ જી.પી.વાય.જી. દ્વારા છેલ્લા ૧૬૪ રવિવારથી વૃક્ષારોપણ જાગૃતિ ઝુંબેશ ચાલી રહેલ છે. જે સંદર્ભે મોડાસાના અલગ અલગ ૪૦ વિસ્તારોમાં વૃક્ષારોપણ કાર્યક્રમ થયા. ૧૭૦૦ જેટલા છોડ વાવવામાં આવ્યા છે. અમદાવાદ, વડોદરા, આણંદ સહિત ગુજરાતમાં અન્ય સ્થાનો પર પણ ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ (જી.પી.વાય.જી.) દ્વારા આ રીતે પર્યાવરણ બચાવ- વૃક્ષારોપણ જતન જાગૃતિ ઝુંબેશ ચાલી રહેલ છે. કેતન દેસાઈ.શાન્તિકુંજ. હરિદ્વાર

પવિત્ર શ્રાવણ માસમાં જલાભિષેકને લઈ કાવડ યાત્રાનો મહિમા વર્ષોથી પ્રચલિત છે. જે અનુરૂપ જન જનને પર્યાવરણ બચાવ- વૃક્ષારોપણ જાગૃતિ માટે વિશેષ સંદેશ આપવા "વૃક્ષ કાવડ યાત્રા"નું સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર મોડાસામાં આયોજન કરવામાં આવ્યું. શાન્તિકુંજ હરિદ્વારથી યુવા અગ્રણી તેમજ દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલયના પ્રતિકૂલપતિ ડૉ. ચિન્મય પંડ્યાજીએ શુભકામનાઓ પાઠવવા જણાવ્યું કે ઈશ્વર ક્ષણ ક્ષણમાં વ્યાસ છે. આ ભાવનાથી નીકળેલી આ વૃક્ષ કાવડ યાત્રાથી લોકોના જીવનમાં પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે વિશેષ ભાવ જાગૃત થાય. આ વૃક્ષ કાવડ યાત્રા મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રથી શુભારંભ થયો. બિલ્ડર કમલેશભાઈ પટેલ, ગોપાલ સ્નેહકાના કલ્પેશભાઈ, તથા નગરપાલિકા પ્રમુખ નિરજ શેઠ દ્વારા વૃક્ષ રથનું પૂજન કરવામાં આવ્યું. નગરપાલિકા પ્રમુખ નિરજ શેઠે લીલી ઝંડી આપી આ યાત્રાનું પ્રસ્થાન કર્યું. યુવાઓ ખભે કાવડમાં શિવજીને પ્રિય એવા વૃક્ષોના રોપાઓ લઈ ચાલતા રહ્યાં. અનેકના હાથમાં પર્યાવરણ બચાવ- વૃક્ષારોપણ જતન માટેના સદવાક્યોના બેનર હાથમાં લઈ પર્યાવરણ બચાવ- વૃક્ષારોપણ ઝુંબેશ માટેના



લાયન્સ કલબ ઓફ અમદાવાદ, જોધપુર હિલ, આવકાર, પરફેક્ટ સન તથા ગાયત્રી પરિવાર નારણપુરાના સહયોગ દ્વારા "પવિત્ર શ્રાવણ માસ" નિમિત્તે નિશુલ્ક પ્રવાસનું આયોજન, " લાયન્સ કલબ ઓફ અમદાવાદ, જોધપુર હિલ, આવકાર, પરફેક્ટ સન તથા ગાયત્રી પરિવાર નારણપુરાના સહયોગ દ્વારા "પવિત્ર શ્રાવણ માસ" નિમિત્તે નિશુલ્ક પ્રવાસનું આયોજન, " ૩૧/૦૮/૨૪.શનિવાર, સવારે ૮:૦૦ વાગે લાયન જીમીશાબેન કંસારા ડિસ્ટ્રિક્ટ ગવર્નરશ્રી, તથા આશાબેન બ્રહ્મભટ્ટ કોર્પોરેટર નવરંગપુરા, લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. લાયન્સ, ગાયત્રી પરિવારના તથા અન્ય મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. બસ ઉપડવાનું સ્થળ : લા. ગીરીશભાઈ પટેલનું નિવાસથાન દેવપથ ૩૧/૦૮/૨૪.શનિવાર, સવારે ૮:૦૦ વાગે લાયન જીમીશાબેન કંસારા ડિસ્ટ્રિક્ટ ગવર્નરશ્રી, તથા આશાબેન બ્રહ્મભટ્ટ કોર્પોરેટર નવરંગપુરા, લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. લાયન્સ, ગાયત્રી પરિવારના તથા અન્ય મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. બસ ઉપડવાનું સ્થળ : લા. ગીરીશભાઈ પટેલનું નિવાસથાન દેવપથ ૩૧/૦૮/૨૪.શનિવાર, સવારે ૮:૦૦ વાગે લાયન જીમીશાબેન કંસારા ડિસ્ટ્રિક્ટ ગવર્નરશ્રી, તથા આશાબેન બ્રહ્મભટ્ટ કોર્પોરેટર નવરંગપુરા, લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. લાયન્સ, ગાયત્રી પરિવારના તથા અન્ય મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. બસ ઉપડવાનું સ્થળ : લા. ગીરીશભાઈ પટેલનું નિવાસથાન દેવપથ ૩૧/૦૮/૨૪.શનિવાર, સવારે ૮:૦૦ વાગે લાયન જીમીશાબેન કંસારા ડિસ્ટ્રિક્ટ ગવર્નરશ્રી, તથા આશાબેન બ્રહ્મભટ્ટ કોર્પોરેટર નવરંગપુરા, લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. લાયન્સ, ગાયત્રી પરિવારના તથા અન્ય મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. બસ ઉપડવાનું સ્થળ : લા. ગીરીશભાઈ પટેલનું નિવાસથાન દેવપથ ૩૧/૦૮/૨૪.શનિવાર, સવારે ૮:૦૦ વાગે લાયન જીમીશાબેન કંસારા ડિસ્ટ્રિક્ટ ગવર્નરશ્રી, તથા આશાબેન બ્રહ્મભટ્ટ કોર્પોરેટર નવરંગપુરા, લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. લાયન્સ, ગાયત્રી પરિવારના તથા અન્ય મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. બસ ઉપડવાનું સ્થળ : લા. ગીરીશભાઈ પટેલનું નિવાસથાન દેવપથ ૩૧/૦૮/૨૪.શનિવાર, સવારે ૮:૦૦ વાગે લાયન જીમીશાબેન કંસારા ડિસ્ટ્રિક્ટ ગવર્નરશ્રી, તથા આશાબેન બ્રહ્મભટ્ટ કોર્પોરેટર નવરંગપુરા, લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. લાયન્સ, ગાયત્રી પરિવારના તથા અન્ય મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. બસ ઉપડવાનું સ્થળ : લા. ગીરીશભાઈ પટેલનું નિવાસથાન દેવપથ ૩૧/૦૮/૨૪.શનિવાર, સવારે ૮:૦૦ વાગે લાયન જીમીશાબેન કંસારા ડિસ્ટ્રિક્ટ ગવર્નરશ્રી, તથા આશાબેન બ્રહ્મભટ્ટ કોર્પોરેટર નવરંગપુરા, લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. લાયન્સ, ગાયત્રી પરિવારના તથા અન્ય મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. બસ ઉપડવાનું સ્થળ : લા. ગીરીશભાઈ પટેલનું નિવાસથાન દેવપથ ૩૧/૦૮/૨૪.શનિવાર, સવારે ૮:૦૦ વાગે લાયન જીમીશાબેન કંસારા ડિસ્ટ્રિક્ટ ગવર્નરશ્રી, તથા આશાબેન બ્રહ્મભટ્ટ કોર્પોરેટર નવરંગપુરા, લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. લાયન્સ, ગાયત્રી પરિવારના તથા અન્ય મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. બસ ઉપડવાનું સ્થળ : લા. ગીરીશભાઈ પટેલનું નિવાસથાન દેવપથ ૩૧/૦૮/૨૪.શનિવાર, સવારે ૮:૦૦ વાગે લાયન જીમીશાબેન કંસારા ડિસ્ટ્રિક્ટ ગવર્નરશ્રી, તથા આશાબેન બ્રહ્મભટ્ટ કોર્પોરેટર નવરંગપુરા, લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. લાયન્સ, ગાયત્રી પરિવારના તથા અન્ય મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. બસ ઉપડવાનું સ્થળ : લા. ગીરીશભાઈ પટેલનું નિવાસથાન દેવપથ ૩૧/૦૮/૨૪.શનિવાર, સવારે ૮:૦૦ વાગે લાયન જીમીશાબેન કંસારા ડિસ્ટ્રિક્ટ ગવર્નરશ્રી, તથા આશાબેન બ્રહ્મભટ્ટ કોર્પોરેટર નવરંગપુરા, લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. લાયન્સ, ગાયત્રી પરિવારના તથા અન્ય મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. બસ ઉપડવાનું સ્થળ : લા. ગીરીશભાઈ પટેલનું નિવાસથાન દેવપથ ૩૧/૦૮/૨૪.શનિવાર, સવારે ૮:૦૦ વાગે લાયન જીમીશાબેન કંસારા ડિસ્ટ્રિક્ટ ગવર્નરશ્રી, તથા આશાબેન બ્રહ્મભટ્ટ કોર્પોરેટર નવરંગપુરા, લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. લાયન્સ, ગાયત્રી પરિવારના તથા અન્ય મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. બસ ઉપડવાનું સ્થળ : લા. ગીરીશભાઈ પટેલનું નિવાસથાન દેવપથ ૩૧/૦૮/૨૪.શનિવાર, સવારે ૮:૦૦ વાગે લાયન જીમીશાબેન કંસારા ડિસ્ટ્રિક્ટ ગવર્નરશ્રી, તથા આશાબેન બ્રહ્મભટ્ટ કોર્પોરેટર નવરંગપુરા, લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. લાયન્સ, ગાયત્રી પરિવારના તથા અન્ય મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. બસ ઉપડવાનું સ્થળ : લા. ગીરીશભાઈ પટેલનું નિવાસથાન દેવપથ ૩૧/૦૮/૨૪.શનિવાર, સવારે ૮:૦૦ વાગે લાયન જીમીશાબેન કંસારા ડિસ્ટ્રિક્ટ ગવર્નરશ્રી, તથા આશાબેન બ્રહ્મભટ્ટ કોર્પોરેટર નવરંગપુરા, લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. લાયન્સ, ગાયત્રી પરિવારના તથા અન્ય મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. બસ ઉપડવાનું સ્થળ : લા. ગીરીશભાઈ પટેલનું નિવાસથાન દેવપથ ૩૧/૦૮/૨૪.શનિવાર, સવારે ૮:૦૦ વાગે લાયન જ